

# भगवान् महापीर



મારો અનુભવ છે, મારી દદિઓ હંમેશાં હું સાચો  
હોઉં છું. આમ છતાં મારા કેટલાક સંનિષ્ઠ કાર્યકરો  
મારામાં કાંઈક ખોટું જુદે છે. પહેલાં હું મને  
સાચો અને સામેનાને અજાની સમજતો પણ  
'અનેકાંતવાદ'નો અસ્થાસ કર્યા પછી હવે મને  
લાગે છે કે બજે પોતપોતાની યોગ્ય રીતે સાચા !  
મહાવરી પ્રરૂપેલા અનેકાંતવાદના સિધ્યાંતે મને  
નવી દદિ આપી છે.

— ગાંધીજી

રૂ. ૨૫/-

# तीर्थंकर भगवान् महावीर



राजेन्द्र भयाभाई शाह

शोठ श्री भयाभाई छाकरशी शाह धर्मांशु ट्रस्ट, १०/११, लब्धी विक्रम, धरणीधर  
देवसर पास, श्रीयांसनाथ सोसायटी सामं, चासणा, अमदाबाद-७. ફ़ ૪૩૫૨૬૬

## ત્રણા સ્વીકાર

પુ. આચાર્ય ભગવંત શ્રી યશોડેવસ્તુરિશ્વરજી મહારાજશ્રીના  
વિપૂલ કલા સંગ્રહમાંથી ભગવાન મહાવીરના ચિત્રો અને  
ભગવાનના જન્મપ્રસંગે એમણે ભગવાનના જીવન-પ્રસંગોનું  
આછું અવલોકન કરતું જે ઉદ્ધોધન કર્યું તે છાપવા બદલ

રાજેન્દ્ર મયાભાઈ શાહ  
૧, પાર્વતિસદન, ૨૨૮, ડૉ. અની બેસંટ રોડ,  
વરલી, મુંબઈ - ૪૦૦૦૨૫. ફોન: ૪૮૩૭૬૪૮

આવૃત્તિ પહેલી  
ચૈત્ર સુદ ૧૩, વીર સંવત ૨૫૧૪  
મહાવીર જન્મ તિથિ

આવૃત્તિ બીજી  
ભાદ્રવા સુદ ૫, વીર સંવત ૨૫૨૦

શેષશ્રી મયાભાઈ ટાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટમાં  
આંખની હોસ્પિટલ શરૂ કરવાના શુભ સંકલ્પ નિભિત્તે

પ્રિન્સ  
ડીપક પ્રિન્ટરી, ૪૪૪, રવિવાર પેઠ,  
પુના : ૪૧૧૦૦૨. ફોન: ૪૫૮૪૭૨, ૪૫૮૯૮૩



शिवमस्तु सर्वं जगतः, परहितनिरतभवन्तुभूतगणाः ।  
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥

समर्पण  
भारा परम पूज्य पिताश्री  
श्री भयाभाई ठाकुरशी शाह  
ने साहर समर्पण

મહાવિરના જીવનનું આણું અવલોકન

મુંબઈની જનમોત્સવની ઉજવણી પ્રસંગે ઉદ્ઘોધન

ઉદ્ઘોધક : પૂર્ણ મુનિશ્રી યશોવિજયજી

नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे ।  
अर्हते योगीनाथाय महावीराय तायिने ॥१॥

पञ्चे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि ।  
निर्विशेषमनस्कायः श्रीवीरस्वामिने नमः ॥२॥

कृतापरायेऽपिजने कृपामन्थरतारयोः ।  
ईषद् वाष्पार्द्धयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥३॥

શ્રીમહ કલિકાલ સર્વજો, ભગવાનને ત્રણ શ્લોક દ્વારા આપેલી ભારોભાર શ્રદ્ધાંજલિનું વિવેચન કરી પછી આગણ વધીએ -





મહાનુભાવો ! આજે આ કાળના અન્તિમ તીર્થકર વીતરાગ, સર્વજ્ઞ, સર્વગુણસંપત્તિ, અહિંસા ધર્મના આધ્ય પ્રભરપુરસ્કર્તા, માત્ર માનવાત ઉપર જ નહિ પણ પ્રાણી જીવમાત્ર ઉપર કરુણા-દ્યાની અવિરત વર્ષા વરસાવનાર, જડચેતન પદાર્થો પ્રત્યે સમભાવ રાખનાર, જીવન-મુક્તિનો માર્ગ બતાવનાર, જીવમાત્રનું ધ્યેય મોક્ષ જ હોયું જોઈ એ અને એ માર્ગના પથપ્રદર્શક એવા મહામાનવ ભગવાન મહાવીરનો- જગતનું કલ્યાણ કરવામાં કારણભૂત એવો - કલ્યાણકનો મંગલમય દિવસ છે.

આજે તમારી સમક્ષ, વિદ્યાપ્રેમી સિદ્ધરાજ અને રાજ્યિ  
કુમારપાલ આ બધાં રાજયોના પ્રતિભોધક, લાગ્યો શ્લોકના રચયિતા,  
સંગ્રહાબંધ મહાન ગ્રન્થ કૃતિયોના રચયિતા, આ કાળના સર્વજ્ઞ જેવા  
આજથી ૧૦૦ વરસ ઉપર અન્ટલે આરમ્ભી સહીમાં થયેલા ગુજરાતની

ወዕሮወዕሮወዕሮወዕሮወዕሮወዕሮወዕሮወዕሮወዕሮ

નગરાધારની પાછાયમાં ભાગન પરમાર્હિત ગુજરાતીશરૂ કુમારપાલ ભાગવાનની વિનંતિથી રથેલા યોગશાસ્ક ગ્રન્થના પ્રાણિમાં બંગડાખણીનું કરીને ભગવાનની જે મણનતા વર્ણવી છે એ જ શલોકનું પવિત્ર ઉચ્ચારણ મેં કર્યું. તમોઓ તેનું પવિત્ર શ્રવણ કર્યું. હવે અનેં શોદું જરૂરી અર્થ સમજુ લઈએ, પછી ભગવાનના જીવનની અલ્પ જાંખી કરીએ -

પ્રથમ શ્લોકમાં નમો દુર્વાર... અનુભગવાનનું વિરોધણ વાયરીને ગ્રન્થકાર એમ જણાવે છે કે, આ સંસાર રાગદ્રોષથી ભરેલો છે. ચારે ભાજુએ એની જ્વાળાઓ ધગધગી રહી છે. સહુ એથી જરી રહ્યા છે. આ રાગદ્રોષ માનવજીતના કદર શત્રુઓ છે. એને જુતવાનું ડામ બાહુ જ દુષ્કર છે. આવા દુર્ઘર શત્રુઓને પણ જે ભગવાને અહિસા, સંયમ, તપ, ત્યાગ વગેરે દ્વારા ભગાડી દઈને જેઓ વીતરાગ અવસ્થાને પામ્યા એવા શ્રેષ્ઠ ચાન્તિવાન નિર્ભળ ભગવાનને હું નમસ્કાર કરું છું.

અહેતિ... બીજા વિશેષણને સમજુએ. વીતરાગ ભનવાથી ભગવાન હવે સાચા અર્થમાં તીર્થકર બન્યા હોવાથી હેવો, મનુષ્યો સહુના માટે પૂજનીય, વંદનીય બન્યા. હેમયંત્રાચાર્યજી રચના યોગશાલની કરી રહ્યા છે, મંગલાચરણ અનુનુ જ છે, એટલે યોગને અનુકૂળ વિશેષણ વાપરતાં લખ્યું કે યોગીનાથાય ભગવાનને યોગીનાથ કહ્યા. એટલે વિશ્વમાં જીતજીતની યોગ સાધનાઓ કરી રહેલા યોગીઓના પણ ભગવાન ઉપરી-નાથ છે, સ્વામી છે, કેમકે યોગના સર્વશ્રેષ્ઠ સાધક માણવીર હતા.

**प्रश्न :** आपहामां जैनधर्ममां पाण योग साधना भरी?

**જવાબ :** ટુકડામાં અપાય તેવો નથી, છતાં પુછ્યો છે તો થોડો અચાલ આપ્યું. વરસોથી આ દેશમાં એક એવો અચાલ સહિતે પ્રવર્તે છે કે યોગ તો હિન્દુઓનો કે અજૈનોનો. જૈનો યોગમાં ખાસ ભાનતા નથી અને



સાથે સાથે ઉત્તર ભારતમાં સેકડો અજૈન યોગીઓ યોગ સાધના કરતા હોય છે તે જાણીતી વાત છે, અને જોગીઓ-જોગીડો શબ્દ પણ અજૈન સંન્યાસીઓ જેડે ખૂબ સંકળાયેલો છે. અને હઠયોગના તો ઘણા ચ્યમતકારો લોકોને જોવા પણ મળે છે. એટલે જૈનો યોગમાં માનતા નથી અની ગેરસમજ ઊભી થાય તે સ્વાભાવિક છે.

જૈનધર્મમાં પ્રાણાયામ, હઠયોગ આહિને સંયમયાત્રા માટે બાધક ગણીને તે અંગે ચેતવણી આપી છે. જૈનોની યોગની વ્યાખ્યા-સાધના અનોખી છે. જો કે પાછળથી કેટલીક યોગની બાબતોને જૈનાચાર્યોએ દેશકાળને અનુલક્ષીને સ્વીકારી છે. આગમ આદિ સાહિત્યમાં યોગસાધનાની વાત વિશેષ પ્રકારે મળતી નથી. મહાપ્રાણધ્યાનની, સર્વસંવરધ્યાનની વાતો મળે છે, જે યોગનું જ અંગ છે. વિકમની પ્રથમ શતાબ્દીથી જીવન સાધનાના ગ્રન્થો રચાવા શરૂ થયા, પછી વિકમની બીજી, ત્રીજી શતાબ્દીથી શ્રેષ્ઠકૃતિ તત્ત્વાર્થસૂત્ર પછી પૂ. જિનભદ્રગણિજી, પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. હેમચંદ્રસૂરિજી, પૂ. ઉપા. યશોવિજયજી આદિ પૂજ્ય ગ્રન્થકારો યોગના સાધકો, યોગ વિષયના પ્રતિષ્ઠિત ઊડા વિદ્વાનો અને બાહુમાન્ય રચનાકારો થયા છે, જેમણે યોગ વિષય ઉપર ઘણું ઘણું લાગ્યું છે.



બીજા શ્રોકમાં ભગવાન મહાવીરે પોતાના મન અને કાયાને કેટલી હુદે સંયમી બનાવી દીધી છે, તે વાત કરતાં ભગવાનના જ જીવનની ઘટનાને યાદ કરીને જણાવે છે. ભગવાનના ચરણમાં સુરેન્દ્ર-ઈન્દ્ર વારંવાર નમસ્કાર કરવા માટે ચરણસ્પર્શ કરતા, બીજુભાજુ ઝેરીલો કૌશિક નાગ ચરણે ડસ્યો પાણ ભગવાનના મન અને કાયામાં કણો કેરકાર ન નોંધાયો, એટલે કે ઈન્દ્ર જેવા નમવા છતાં ભગવાનને હરભ કે આંદોભાવ જાગ્યો

નહિ અને જ્યારે નાગ ડસ્યો ત્યારે તેના પ્રત્યે મનમાં દ્રેપ-રોપ જાગ્યો  
નહિ, એટલે આચાર્યશ્રીજી લાગે છે કે પરસ્પર વિરોધી-ઉભય  
પરિસ્થિતિ વચ્ચે મન-ડાયાની સમતુલા જાળવનારા એવા ભગવાનને  
હં નમું છું.

— 1 —


ત્રીજ શ્લોકમાં ભગવાનની ૧૨ા વર્ણની ધોર સાધના દરમિયાન એક ઘટના બનેલી. એ ઘટનાની વાત આ શ્લોકમાં જણાવી તેને અનુલક્ષ્ણીને સાધનાકાળ દરમિયાન ભગવાન ધ્યાનની ડેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હતા તે જણાવે છે. ભગવાનની ટોચે પહોંચેલી કરુણાની વાત જાહેર કરીને ગ્રન્થકાર ભગવાનના નેત્રોને મિરદાવે છે. કેવળજ્ઞાન થતાં પહેલાંની સાધના દરમિયાન સ્વર્ગના સંગમદેવે ભગવાનને ધ્યાનભંગ કરવા ધરતી ઉપર આવીને એક પછી એક ઉપસર્ગો, અસહ્ય ઉપદ્રવોની હારમાળા ખડી કરી દીધી. છેહે ભયંકર કાળચક મૂક્યું. અતુલભલી છતાં ભગવાન ધરતીમાં ખૂંપી ગયા પણ ભગવાન ધ્યાનથી ચલિત થયા નહિ. સાધના-ધ્યાન આપંડ રહ્યાં. સંગમનાં તમામ શરૂઆતની જન્મની ગયાં-પરાજિત થઈ ગયાં.

100

સંગમ અપરાધી હતો, ગુનેગાર હતો. સામાન્ય રીતે અપરાધી ઉપર જલદી હોઈ હ્યા ન કરે પણ અપરાધ માટે સજા કરે, પણ આ વાત તો સામાન્ય ભાનવીઓ માટે હોઈ શકે, પરંતુ આ તો હતા કરુણામૂર્તિ ભગવાન ! અપરાધી ઉપર પણ ઉપકાર કરનાર અને ક્ષમા બક્ષનાર મહાભાનવ હતા. મહાપુરુષોની મહાનતાની આવા પ્રસંગે જ કસોટી થાય છે. એરલે પોતાને ત્રાસ આપ્યો અની ભગવાને કશી ચિંતા


કરી નહિ. અપરાધી પ્રત્યે ન રોષ, ન ગુસ્સો, ન તિરસ્કાર પણ ઉલંડું આગળ વધીને ભગવાનના હૈયામાં કરુણા હતી તેથી ચિંતા ઉભરાઈ ગઈ. બીજાને ત્રાસ આપ્યાનું ભયંકર પાપ જાંખનાર આ જીવનું ભાવિ કેવું ભયંકર હુઃખદ હશે એ વિચારતાં ભગવાનના બને નેત્રો લીનાં થઈ ગયાં-ઝળઝળિયાં આવી ગયાં એમ જલાવીને નેત્રોને મિશ્રાયાં.

અમના વારસદારો તરીક આપણે પણ રાગ-દ્વેષથી બચતા રહીએ, સુખદુઃખ વચ્ચે સમતાભાવ રાખીએ અને આપણા અપરાધીઓ પ્રત્યે ઉદારભાવ રાખી કરુણા દાખવીએ.



આર્થભૂમિથી અલંકૃત આ ભારતહેશ એ ઈશ્વરોની- અવતારોની ભૂમિ છે, સંતો-ઋષિ-મહર્ષિઓનું નિવાસસ્થાન છે. આવી પવિત્ર ભૂમિ ઉપર આજથી ૨૫૬૫ (અઠી હજાર વર્ષ ઉપર) વર્ષ ઉપર (ત્રિશાલા માતાની કુક્ષિથી) એક મહાન તેજ પ્રગટ થયું હતું, અને તે ધીમે ધીમે ભારતના મોટા ભાગ ઉપર પથરાઈ ગયું હતું. એ તેજ-ગંગામાં ભારતના અનેક રાજ-મહારાજાઓ, રાજરાણીઓ, રાજકુમારો, રાજકુમારિકાઓ, ગરીબો અને અમીરો, બાળકો અને વૃદ્ધો, નવયુવાનો અને નવયુવતીઓ વગેરે લાખો લોડો સ્નાન કરીને પાવન થયા હતા. એ તેજ બોતેર-બોતેર વર્ષ સુધી પોતાનો મંગલ અને કલ્યાણકારી પ્રકાશ પાથરીને અંતે આપણા દુર્ભાગ્યે વિલય થયું હતું, જે તેજને વિલય થયે આજે ૨૪૬૩ વર્ષ થયાં એટલે કે વિ. સં. નાં ૨૦૨૩ વર્ષ થયાં.

આ તેજ કે પ્રકાશ બીજા કોઈનો નહિ, એ તેજ હતું આ યુગના ચરમ તીર્થકર, અન્તિમ પરમાત્મા, શાસનપતિ શ્રમણ ભગવાન



મહાવીરના આત્માનું, ભગવાન મહાવીર અહિસાના પરમવિભૂતિ સ્વરૂપ હતા, સાચા દશા હતા અને દીર્ଘતપસ્વી તરીકે વધુ જાણીતા થયા હતા. આ વિભૂતિનો જન્મ ચૈત્ર સુહિ તેરસની મધ્યરાત્રિએ થયો હતો, એટલે અઢી અઢી હજાર વર્ષ પસાર થવા છતાં આજે આપણે અને ભારતના લાખો લોકો એ મહાન આત્માના જન્મદિનની વિવિધ રીતે ઉજવણી કરવા દ્વારા તેમના મહાન આત્માને યાદ કરશે અને અનંતગુણી એ પરમ ઉપકારીના ગુણોના ગુણાનુવાદ ગાઈને અભેદના મહાન ગુણોને, મહાન ઉપકારોને ભાવભીની શ્રદ્ધાંજલિઓ અર્પણ કરશે.

અંતિમ તીર્થકર ભગવાન મહાવીર ક્યાં જન્મ્યા હતા, કોણે ત્યાં જન્મ્યા હતા? એમનું ગૃહસ્થજીવન અને ત્યાર પછી સાધુ જીવન કેવું હતું. એમના જીવનમાં જન્માન્તરનું સાથી બનેલું મહાન જ્ઞાન જન્મતાં જ કેવું લાગ્યા હતા. એમનું ચારિત્ર કેવું અનુપમ કોટિનું હતું. સાધુ અવસ્થાનો સ્વીકાર કર્યા બાદ વિશ્વના કલ્યાણ કરવા માટે જોઈતી આધ્યાત્મિક તાકાત મેળવવા તેમણે તપ અને ત્યાગમાર્ગની કેવી અનુપમ કોટિની સાધના કરી હતી. એમના જીવનમાં દયા, ક્ષમા, કરુણા અને પ્રેમનો નાયગરાના ધોધ જેવો કેવો મહાસ્નોત વહેતો હતો? એ કેવા મહાન હતા એમના સિદ્ધાન્તો કેવા લોકકલ્યાણકર હતા, તેની આછી પતલી ઝાંખી કરવા આજે આપણે એકત્રિત થયા છીએ. એ બધી બાબતો યશોચિત અન્ય વક્તાઓ કહેશે. હું તો બહુજ સંકોપમાં કહીને મારી જીહ્વા, મન અને આત્માને પવિત્ર કરીશ.

ભગવાન મહાવીર મિહારની મહાન પુણ્યભૂમિ ઉપર જન્મ્યા હતા, જન્મ્યા ત્યારથી જ તે મહાન જ્ઞાની હતા એટલે કે ભતિ, શ્રુત, અવધિ આ નામના ત્રાણ જ્ઞાન સાથે જન્મ્યા હતા. બાલ છતાં અભાલ હતા, ચુવાન વધે પહોંચ્યા બાદ જ્ઞાનદિશી અભિલ વિશ્વને જન્મ,

જરા, ભરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, સંતાપ વગેરે અનેકવિદ્ય હું: ખોથી ગ્રસ્ત થયેલું જોઈ દ્યા અને કરુણાથી ઉભરાતું તેમનું હદ્ય દ્રવી ગયું. તેમને એમ થયું કે કેવળ માનવજીત માટે જ નહિ પણ સમગ્ર પ્રાણી સૃષ્ટિને માટે, એ પછી મનુષ્ય હોય, પશુ હોય કે કુદુર જંતુ ઇપે હોય પણ જે મારામાં કોઈ એવી દિવ્યશક્તિ પ્રાપ્ત થાય તો તેમને સાચી શાંતિનો, સાચા સુખનો, કલ્યાણનો સાચો રાહ બતાવું. એમનું મંથન ઉગ્ર બન્યું અને ઈશ્વરભા મેળવવા રાજમહેલનો વૈભવ છોડ્યો. કુટુંબ કબીલો અને દોલત છોડી. સંસારી મટીને સાધુ બન્યા, એ વખતે એમણે સાધુ જીવનની પાંચ લીધમ પ્રતિજ્ઞાઓ લીધી. આજથી લઈને આજીવન સુધી અર્થાત્ જીવનની અંતિમ ક્ષણ સુધી મનસા, વાચા, કર્મણા-મનથી, વચનથી કે કાચાથી કોઈપણ પ્રાણીની હિંસા કરીશ નહિ, કરાવરાવીશ નહિ અને જે કોઈ કરતાં હોય તેને હું ટકો આપીશ નહિએ જ રીતે જુહુ, ચોરી, લીસેવન કે પરિગ્રહનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તે જ વખતે ચોથું મન:પર્યવ્યાન ઉપયું. હુનિયાના મનુષ્યોના, પશુના સર્વના મનના વિચાર જાણવાને સમર્થ બન્યા. અને રખે કોઈ પાપ ન થઈ જાય તે માટે પૂર્ણ સાવધાન બન્યા, રખે કંઈ પ્રમાણ ન થઈ જાય એ માટે જાગૃત બન્યા, સાથે સાથે ઉપવાસોની તપશ્ચિર્ય શરૂ કરી, ગામે ગામ, નગરે નગર, જંગલે જંગલમાં વિહાર કરવા માંડ્યો. મુખ્યત્વયા મૌનપણે વિચરે છે. આત્માનું શુદ્ધિકરણ (રિક્ષાઈન) કરવાની ખોજમાં ભગવાન અંતમુખ બન્યા. બહિર્મુખ ભાવનો પરિત્યાગ કર્યો છે. શારીરિક સુશ્રૂતા કે સારસંભાળને તિલાજલિ આપી છે. શરીરની મુખ્ય અનિવાર્ય જરૂરિયાતો આહાર અને નિદ્રા એનો પણ (લગભગ) ત્યાગ કર્યો છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કાઉસ્સગું મુદ્રાએ રહીને ધ્યાનમાં એકાતાર બની જાય છે. એ અવસ્થામાં અને અન્ય પ્રસંગોમાં ગમે તેવા લયંકર

ઉિપદ્રવો, ઉિપસર્ગો થાય, કોઈ તેમને સન્માન આપે કે અપમાન કરે  
પણ પૂર્ણ સમભાવે હર્ષ પૂર્વક સહન કરે છે, અને એ દ્વારા નવાં કર્મોનિ  
આવતાં રોકે છે અને પુરાણાં કર્મને ખંખેરતા જાય છે તેમ જ આત્મિક  
જ્ઞાનની જ્યોતિને પ્રજ્વલિત કરતા જાય છે. ડેવલજ્ઞાન-ત્રિકાળજ્ઞાન-ના  
પ્રકાશ આડાં આવરણોને હઠાવતા જાય છે. તેમજ એમની સાધનાનો  
વેગ પ્રચંડ બનતો જાય છે. આમ કરતાં સાડાભાર વરસ થયાં, આત્મા  
ઘણી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો છે. વિશ્વનાં પ્રાણીમાત્ર સાથે અભેદભાવ  
જેના હૈયામાં ઉત્પત્ત થયો છે હું-તુંનો ભેદભાવ સર્વથા વિલીન થઈ  
ગયો છે. હુમાં તું ને તુંમાં હું જ જેઓ જોઈ રહ્યા છે. આત્મા અહિંસક  
ભાવની પરાકાશએ પહોંચ્યો છે. હું તું (તે) સર્વનામોનું સ્થાન ગયું.  
સમગ્ર જગતને આત્મૌપમ્ય દદ્ધિએ જુયે છે. મોટાભાગના જોરદાર  
કર્મશત્રુઓને મહાત કરી નાંદ્યા છે. આત્માને તાવી તાવીને શુદ્ધ કંચન  
જેવો બનાવી દીધો છે. એવા પ્રસંગે પોતાના જ્ઞાન પ્રકાશના મહાન  
પૂજને રોકનારા ધાતી કર્મના દરવાજ ઝડપથી ખુલ્લી જાય છે,  
આવરણના પડહાયો હઠી જાય છે અને ભગવાનને ડેવલજ્ઞાન પ્રગટ  
થઈ જાય છે. આ જ્ઞાન ત્રૈકાળિકજ્ઞાન છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાન  
ત્રણેય કાળનાં દ્રવ્યો અને પર્યાયોને જોવા અને જાણવાની શક્તિનો  
પ્રાહુર્ભાવ થાય છે અને અભિલ વિશ્વની પરિસ્થિતિનો સાચો તાગ તેમને  
મળી જાય છે. વિશ્વનાં સત્ત-અસત્ત પદાર્થોનિ, તેના ભાવોને જુયે છે.  
હેય શું છે! ઉપાદેય શું છે! તે જુયે છે. સંપૂર્ણ, શાશ્વત અને નિર્ભેણ  
સુખ શું? તે કયાં છે, તે મેળવવાનો માર્ગ કયો? અને પારાવાર દુઃખો  
ભોગવાં શાથી પડે છે વગેરે બાબત તે જોતા અને જાણતા થયા એટલે  
ભગવાન ડેવલી થયા અને અસંખ્ય ઈન્દ્રો, દેવો, મનુષ્યો આદિથી  
પૂજાતા થયા. પછી સમોસરણમાં બેસીને ૩૦ વર્ષ સુધી  
ધર્મદિશના-પ્રવચનાં આવ્યા. હજારો-લાખો માણસોએ એ પ્રવચનાં

જીવિયાં. હજારોએ સાધુધર્મ અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. હજારોએ સમ્યગ્દર્શનનો પ્રકાશ મેળવ્યો. હજારોએ શ્રાવકધર્મ તથા શ્રમણમાર્ગની ઉત્કૃષ્ટ આરાધના કરી, ધાતીકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીર વિશેષદ્વારે ભગધની ભૂમિ ઉપર વિચરી સોળ પ્રહર-૪૮ કલાકની લાંબી દેશના આપી બાડીના ચાર અધાતી કર્મનો ક્ષય કરી અસંખ્ય યોજન ફૂર આકાશમાં આવેલ સિદ્ધશિલા ઉપર કાયમને માટે સ્થિત થયા. ભગવાને પોતાના જન્મ-મરણના કેરા બંધ કર્યો, સર્વ દુઃખોનો અંત કર્યો અને અનંતા સુખના ભોક્તા બન્યા.

આવા અનંત ઉપકારી જન્મોજન્મ કલ્યાણ કરનારા, પ્રાણીમાત્રને આત્મકલ્યાણનો સાચો રાહ બતાવનારા રાહખર પરમાત્માને આજે કોટિ કોટિ વંદન કરીએ. એમણે ચીધિલા અહિંસા સત્યના મર્ગે ચાલીએ. ભગવાનને એ જ મોટામાં મોટી અંજલિ આપી ગણાશે. અંતમાં મંગલ અને કલ્યાણકારી એક પ્રાર્થના કરી લઈએ.


शिवमस्तु सर्व जगतः, परहितनिरताभवन्तुभूतगणाः ।  
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥

અર્થात् સમગ્ર જગત સુખી થાઓ, તમામ પ્રાણીઓ બીજાનું ભલું કરવામાં જ મચ્યાં રહો. તમામ પ્રાણીઓના તમામ દોષો નષ્ટ થાઓ અને આ સમગ્ર વિશ્વ એઠલે ત્રણેય લોકના જીવાત્માઓ બધી રીતે સુખી રહો.

ભારતીય સંસ્કૃતિની આ ઉદાત્ત પ્રાર્થના કરીને મારા વક્તવ્ય ઉપર  
હં પૂર્ણવિરામને સ્થાન આપું છું.


## આચાર્ય શ્રી યશોદેવસૂરિશ્વરજી

浙教版七年级数学上册 第一章 有理数 1.1 正数和负数



ભગવાન મહાવીરના મહત્વના  
આત્મસાધનાના રૂપ પૂર્વલયો





दशभा स्वर्गलोकमां २६ भो भव पूर्ण करी  
देवनन्दानी कुक्षिमां भगवानन्तु अवतरण





કુલાભિમાનના કારણે પ્રાહીણકુલમાં ગર્ભપણે  
અવતરેતા મહાવીરનું ગર્ભપરાવર્તન અને  
પ્રાહીણી દેવાનંદાનું પતિને સ્વભન્કથન






देवानंदानी कुक्षिभांधि राणी त्रिशतानी कुक्षिभां  
गर्भनुं स्थापन करवा हरिषेगमेधीनुं प्रयाण



१७



નિશાલાદ્વીએ ગર્વના પુણ્યપ્રભાવે જોયેલાં  
તીર્થકર-જનમ-સૂર્યક ૧૪ મહાસ્વાનો





नवजात पुत्रने निश्चलाभाता समक्ष पद दिक्कुमारिकाओं  
द्वारा विविध जन्मकृत्योनुं विधान



१६



२०

અહિતિના અભિલાષી સૌધર્મનિશ્ચં પાંચ રૂપ  
ધરી ભગવાનને લઈ મેરુપર્વત તરફ પ્રયાણ





મેરુપર્વત ઉપર સૌધર્મેન્દ્ર તથા અન્ય દેવ-દેવીઓ  
દ્વારા ઊજવાઈ રહેલો જન્માલિંગક મહોત્સવ




૨૧



भयंकर राक्षसी दृप द्वारा भगवानना धैर्यनी करेली  
परिक्षा अने त्यारबाट देवगण द्वारा  
‘महावीर’ नाम स्थापन






ભાહીશરૂપધારી ઈન્દ્રજા પ્રશ્નાદ્વારા  
લગ્વાનની જાનકર્યોત્તિનું પ્રકાશન






કુંભીજનો સમક્ષ લગવાનનો  
ધાર્મિક ઉપદેશ






દીક્ષાની અનુમતિ માટે ભગવાનની પ્રાર્થના  
અને વડીલ બંધુ નંદિવર્ધનની હાદિક વ્યથા





नव लोकान्तिक देवोनी भगवानने विश्व  
कल्याणार्थं दीक्षा स्वीकारवानी विनांति






ॐ

ભગવાને એક વર્ષ સુધી દીન-દુઃખી  
જનોને કરેલું અણોડ દાન


જીજ

૨૭




ભગવાનનું મહાલિનિષ્ઠમણ અને દેવમાનવ  
સહિત અતિભાર્ય દીક્ષાયાત્રા






કેશલોચ કરી, પાંચ મહિનોની આજુવન  
પ્રતિજ્ઞા અને દીક્ષાનો સ્વીકાર





શરીર પરની સુગંધ અને સૌદર્યથી આકૃત્ય  
નર નારીઓના અનુકૂળ ઉપસર્ગ છતાં  
ભગવાનના ચિત્તની શ્રેષ્ઠ સ્વસ્થતા।





દરિદ્ર ભાહાણની યાચના અને  
ભગવાનનું અનુકૂપા દાન






ભગવાનને ચોર સમજુ મારવા તૈયાર થયેલા ખેડૂતને  
રોકવા સ્વર્ગમાંથી ઇન્દ્રજીનું શિધ આગમન





શૂલપાણિ યક્ષે કરેલ પ્રતિકૂલ ઉપસર્ગો  
અને લગવાનની અપૂર્વ સમતા






S. MARVEKAR




ચાણકીશિકે કરેલો ભરણાન્ત ઉપસર્ગ, ઉંમભાંથી  
નીકળેલું ખેત રૂધિર અને લગવાનનો સદ્ગત પ્રતિબોધ






मुंद्रांश्च देवनो जलद्वारा नावोपसर्गं अने  
कुबल-शंभल देवो द्वारा सहुनी रक्षा






સંગમદેવ કરેલા અતિ દારુણ ઉપસર્ગો  
અને ભગવાનની અદ્ભૂત ક્ષમા






અતિકઠિન અલિગ્રહની સમાચિ થતાં ચંદ્રબાળાએ  
આપેલું બાકળાનું દાન અને હેવકૃત દાન પ્રભાવ







ગોવાળિયા દ્વારા ભગવાનના બંને કાનમાં  
અભીલા ઠોકવાનો મહાઉપસર્ગ અને  
વિજાવૈદ્ય દ્વારા તેનું નિવારણ






संयम अने तपनी उग्रसाधनाथी प्राप्त  
परम समाधिमां लयलीन भगवान्






ગોદોહસનમાં પ્રલુ પામ્યા કેવળજ્ઞાન





કેવળજ્ઞાનની પ્રાપ્તિબાદ અશોકવૃક્ષ નીચે  
ભગવાનનું અદ્ભુત અને અમોદ ધર્મ પ્રવયન






બોધ પામેલા ૧૧ બ્રાહ્મણ પંડિતોને દીક્ષાપ્રદાન  
અને તેઓની ગણધરપદે સ્થાપના






ભગવાનને ભરમીભૂત કરવા છોડેલી પણ પાછી  
ફરેલી 'તેજેલેશયાનો' ગોશાલકના જ મુખમાં પ્રવેશ






ભગવાને વિશ્વકર્માણાર્થે ૧૬ પ્રાહ્ર  
સુધી કરેતું અંતિમ પ્રવચન





ચંદ્રની ચિત્તા ઉપર પધરાવેલ પવિત્ર હેણનો  
દેવો - મનુષ્યો દ્વારા અભિસંસ્કાર





मुख्य शिष्य गणधर श्री गौतम स्वामीजीना  
डेवलज्ञान प्राप्ति बाधनी प्रथम देशना





શ્રી શાંખેશ્વર પાર્શ્વનાથ



૮૭



४८

અલોકિક પદ્માવતી દેવી



# શોઠશ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્મદા ટ્રસ્ટમાં ચાલતી પ્રવૃત્તિઓ...

## મેડીકલ સેટ્ટ

- હોમીયોપેથીક કલીનીક
- એલોપેથીક કલીનીક
- આયુર્વેદિક કલીનીક
- એક્યુપ્રેશાર ટ્રીટમેન્ટ

## ડેંટલ કલીનીક

પોલી કલીનીક જેમાં નિષણાત

- ફીજીશીયન કાઉન્સિલોજીસ્ટ ડૉક્ટર
- ચામડીના દદના ડૉક્ટર
- એન. ટી. અને ● ઓર્થોપીડીક સર્જન ડૉક્ટર
- ઈ. એન. ટી. અને ● સ્લી રોગોના નિષણાત ડૉક્ટરોની સેવા  
પેથોલોજીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં કુલ બ્યાંડી  
ચેક-અપની પણ સુવિધા છે.

## આંખની હોસ્પિટલ

- મોતીયાના સાઢા તથા નેત્રમણી સાથે ઓપરેશન ટ્રીટમેન્ટ
- ઝામર - નાસુરના ઓપરેશન તથા ટ્રીટમેન્ટ
- આંજણી - ખીલ વિગેરે અંગેના ઓપરેશન
- આંખોના દરેક દર્દ અંગેની સારવાર

દર્શોજ ઓ. પી. ડી. ની સુવિધા.

## શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર

- સીવણ - ભરતના વર્ગો
- ડ્રોઇંગ - પેઇન્ટિંગના વર્ગો
- સંગીતના વર્ગો
- મેદીના વર્ગો

શોઠ શ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્મદા ટ્રસ્ટ, ૧૦/૧૧, લબ્ધી વિકાસ, ધરણીધર  
દેરાસર પાસે, શ્રેયાંસનાથ સોસાયટી સામે, વાસુદાન, અમદાવાદ-૭. ફોન: ૪૩૪૨૮૯

